

જુલાઈ-૨૦૧૬

સંક - ૨૩




સંપાદકીય બોર્ડ

- એચ.કે. જોષી
- એસ.જે.મેહતા
- એમ.એમ.ઠક્કર



અનુક્રમણિકા

દર આંગણની  
અમૂલ્ય ઔષધિઓ  
હિંદી કે ક, સ્વ, ગ  
મિત્રતા એક અનમોલ  
નજરાણું  
"મા"ં  
જાત મહેનત જિંદાબાદ  
દર્દ એક દવા એક  
શાળા ની પ્રવૃત્તિઓ





# દર આંગણાની અમૂલ્ય ઔષધિઓ



શેલેષકુમાર જયંતિલાલ મહેતા,  
આચાર્યશ્રી, શ્રી એસ.કે.વી.વિદ્યાપીઠ

## નગોળ



- (૧) નગોળના પાનને દીવેલ સાથે ગરમ કરી લગાવવાથી સોજમાં તથા દુઃખાવામાં સારો ફાયદો થાય છે.
- (૨) વાના રોગ અથવા અંગ જકડાઈ જવામાં નગોળના પાનનો ઉકાળો પીવાથી ખુબ જ લાભ થાય છે.
- (૩) સાંધાના રોગ તથા વાના રોગમાં નગોળના પાનને ઉકાળીને તેની વરાળનો સેક કરવાથી ખુબ ફાયદો થાય છે.

## ગરમાળો



- (૧) ગરમાળાની શીંગમાંથી નીકળેલ ગોળ બાળકોના કબજાતમાં સુખ વિરેચન તરીકે વપરાય છે.
- (૨) ગરમીમાં ગરમાળાના ફુલોને પાણીમાં નાંખી નાહવાથી ફાયદો થાય છે.

## અજમો



- (૧) રોજ ભોજનમાં નિયમિત અજમાનો ઉપયોગ ગેસ, અપચો, અરૂચિ, કૃમિ વગેરેમાં ઉપયોગી છે.
- (૨) ગોળા અને અજમો ખાવાથી શીળસ(શરીરની ખંજવાળ) માં ફાયદો થાય છે.
- (૩) વધુ પડતા પેશાબ માટે જવું પડતું હોય તો અજમો અને તલ એકત્ર કરી લેવાથી ફાયદો થાય છે.

## તુલસી



- (૧) શરદી, ખાંસી, શ્વાસ અને કફના રોગોમાં તુલસીના રસને આદુના રસ અને મધ સાથે પીવાથી ફાયદો થાય છે.
- (૨) નિયમિત પણે તુલસીના ૮-૧૦ પાન ચાવીને ખાવાથી શરીરનું તેજ, ઓજ, મેઘા તથા રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે ઋતુજન્ય રોગોથી બચાવે છે.
- (૩) સામાન્ય તાવમાં તુલસીના પાન તથા મરી લેવાથી ફાયદો થાય છે.

## લીમડો



- (૧) લીમડાના પાંદડાનો રસ પીવાથી ચામડીના રોગો, ગડ, ગુમડા મટે છે. તેના પાનને ઉકાળી તૈયાર પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગોમાં ફાયદો થાય છે.
- (૨) લીમડાના પાનની ધૂણી કરવાથી જીવાણુ, મચ્છર વગેરે નાશ પામે છે અને હવા શુદ્ધ થાય છે.
- (૩) લીમડાના ફૂલા પાન અથવા ફુલને મરી અને ખાંડ સાથે ઉપયોગ કરવાથી ઋતુજન્ય અનેક રોગોથી બચી શકાય છે.



## સરગવો

- (૧) શરીરનો દુઃખાવો , સોજો , સાંધાના કે વાના રોગોમાં તેની સીંગોનું શાક , જયુસ અથવા સુપનું સેવન ખુબજ ફાયદાકારક છે.
- (૨) સરગવો યકૃત , બરોળ તથા આંખ માટે પણ ખુબ જ હિતકારી છે.
- (૩) સરગવાના પાન ખુબ જ પૌષ્ટિક હોવાથી આપણે આહારમાં તેની બનાવટો જેવી કે મઠીયા , થેપલા વગેરે ખાસ ઉપયોગ કરી શકીએ.

## કુવારપાઠુ

- (૧) પિત્તદોષ , ખાંસી , યકૃતના રોગો , તાવ , ગાંઠો , ચામડાના રોગો તથા પેટના રોગોમાં ઉપયોગી છે.
- (૨) કુવારનો રસ હળદર નાંખીને પીવાથી ફાયદો થાય છે.
- (૩) દાઝયા ઉપર કુવારનો ગર્ભ લગાવવાથી તરત જ દાહ શમન તથા ઝડપી રૂઝ આવે છે અને ડાઘ પણ રહેવાની શક્યતા ઓછી રહે છે. કુવારપાઠાનો રસ શરીરમાં શક્તિ તથા સ્ફુર્તિ વધારનાર છે.

## ગળો

- (૧) બધા પ્રકારના તાવમાં ગળાની છાલને સાકર સાથે આપવાથી ફાયદો થાય છે.
- (૨) ડાયાબીટીસ , નબળાઈ , કમળો , ચામડાના રોગોમાં ગળોનો રસ પીવાથી ફાયદો થાય છે.


# हिंदी के क, ख, ग

क, ख, ग क्या कहता है जरा गौर करें... "क"- क्लेश मत करो! "ख"- खराब मत करो! "ग"- गर्व ना करो!  
"घ"- घमण्ड मत करो! "च"- चिंता मत करो! "छ"- छल-कपट मत करो! "ज"- जवाबदारी निभाओ!  
"झ"- झूठ मत बोलो! "ट"- टिप्पणी मत करो! "ठ"- ठगो मत!  
"ड"- डरपोक मत बनो! "ढ"- ढोंग ना करो!  
"त"- तैश मे मत रहो! "थ"- थको मत! "द"- दिलदार बनो!  
"ध"- धोखा मत करो! न- नम्र बनो! "प"- पाप मत करो!  
"फ"- फालतू के काम मत करो! "ब"- बिगाड मत करो!  
"भ"- भावुक बनो! "म"- मधुर बनो!  
"य"- यशस्वी बनो! "र"- रोओ मत! "ल"- लोभ मत करो!  
"व"- वैर मत करो! "श"- शत्रुता मत करो! "ष"- षटकोण की तरह स्थिर रहो!  
"स"- सच बोलो! "ह"- हँसमुख रहो!  
"क्ष"- क्षमा करो! "त्र"- त्रास मत करो!  
"ज्ञ"- ज्ञानी बनो..!!\_



Bina D. Bhatt  
Sec. School Teacher





Hard times  
will always reveal  
true friends.



પી.જી. પ્રજાપત્  
ઉચ્ચ. માધ્ય. શિક્ષક

## મિત્રતા એક અભાગ જાણું

મિત્રતા એટલે શું ? ઈશ્વર જેમને લોહીના સંબંધથી જોડવાનું ભૂલી ગયા હોય એવી વ્યક્તિઓને મિત્રો બનાવી ઈશ્વર પોતાની ભૂલને સુધારી લેતા હોય છે. “ જે આપણાં દોષોનો અસ્ત કરે તે દોસ્ત ”. સાચી દોસ્તીમાં ખૂબ તાકાત હોય છે.

એવું કહેવાય છે કે દોસ્તી હંમેશા સાણસી જેવી રાખવી જોઈએ સામેનો દોસ્ત ભલે ગમે તેટલો ગરમ થાય પણ મૂકે એ બીજા. આ જ ખરી દોસ્તી છે. એકાદ સારું ગીત આપણને પાંચ મિનિટ સારી ફિલ્મ આપણને ૩ કલાક અને સારી કોલેજ હોયતો ૩ વર્ષ આનંદમય વીતે પરંતુ સારા મિત્રોથી જિંદગી આનંદમય બની જાય.

દોસ્તી એટલે એક ખભાનું સરનામું જ્યાં દુઃખની ટપાલ ટિકીટ વિના પોસ્ટ કરી શકાય છે. દોસ્તી ક્યારેય સારા માણસોથી નથી હોતી. જેનાથી દોસ્તી થાય એ લોકો જ ખાસ બની જાય છે.

દોસ્તી એ નથી કે જે જીવ આપે છે દોસ્તી એ પણ નથી કે જે ખુશી આપે છે. પરંતુ સાચી દોસ્તી એ છે કે જે પાણીમાં પડેલું દોસ્તનું આસું પણ ઓળખી લે છે. દોસ્તી સુદામા-કૃષ્ણ જેવી, રાધા - કૃષ્ણ જેવી, અર્જુન-કૃષ્ણ જેવી કે રામ - સુગ્રીવ જેવી હોવી જોઈએ. પહેલાના કાળમાં અગ્નિની સાક્ષીએ મિત્રતાના સોગંધ લેવાતા હતાં

ખરેખર દોસ્તી લોહીનો નહિ પણ દિલનો સંબંધ છે. કોઈને ન કહી શકાય તેવી વાત જેને કહી શકાય તે દોસ્ત. જેની સાથે હસી શકાય એ નહિ પણ જેની પાસે રડી શકાય એ મિત્ર છે. આવા સારા મિત્રો જીવનમાં મળવા એ ખરેખર જીવનનું મહાન સદ્ભાગ્ય છે.





# "माँ"



"काश"

काश्मीरा डिभांशु गोर

माँ- में ओर तुम दो जिस्म एक जान ।

दो दिल एक अरमान, तेरे तन ओर मन में सिर्फ में ओर मेरे तन ओर मन में सिर्फ तुम ।

पुरे नौ महीने ओर नौ दिन । हम एक दूसरे में समाये हुए । वह तेरे ही हाथ का पहला स्पर्श था, जो मेरे तन को छूतेही जन्नत तक भूला दिया ।

शायद मेरी वो पहली रुदन थी जिस पर तू दिल से मुस्कुरा उठी थी । एकादशी के दिन हम एक दूसरे से अलग अस्तित्व मिला, कितना भरोसा था, भगवान को तुम पर जो कोमल से हाथ में बेटी को पालने का भार सौंप दिया ।

तूने किस दूढ इरादो से पाला-पोसा । अपना मान सम्मान और व्यक्तित्व बनाना सिखाया ।

और तकिरबन 60साल के बाद कुछ ऐसा ही हुआ ।

आज भी ऐसा ही माहौल था । पूर्णिमा की साम थी ।

तू ओर में एक दूसरे के मन में समाये हुए थे ।

तू ओर में एक दूसरे को आखिरी बार देख रहे थे । मेंने देखा था 'माँ' तैरी आँखो में मारा ही चेहरा था । ओर मेरे कमजोर से हाथ में तेरा चेहरा था । जो दुध खून बनकर रगों में दौड़ रहा था, आवाज़ जो शैर की दहाड़ से भी उंची थी । तूझे जातें हुए देख । 'मिल् मिल् ने लगीं । सारा खून आँखो से बह निकला । में कितना रोई 'माँ' पर पहल बार तू ने "गुडिया" कह कर गले नहीं लगाया ।

एक ही तो वो क्षण था । जब में आइ इस दुनियां में तेरे भरोसे तैरे हाथों में, ओर तू बिदा हो गई इस दुनियां से मेरे ही हाथों में "माँ" ।





Building  
Self-Confidence

## જાત મહેનત જિંદગી



ડૉ. એન.વી. સોરઠીયા  
ઉચ્ચ.માધ્ય.શિક્ષક

‘ હાઉ યુ થિંક ઈઝ એવરથિંગ ’ મતલબ આપણે આપણાં વિશે શું વિચારીએ છીએ એ ખૂબ જ મહત્વનું છે. આપણાં આ વિચારો એ જ આપણાં કામમાં પ્રતિવર્તિત થતા હોય છે. આપણે જેવું વિચારશું એવો પ્રતિભાવ આપણને બીજા લોકો તરફથી મળશે. આપણે આપણી જાતને નીચા આંકશું તો સામેની વ્યક્તિ પણ શાયદ આપણું મૂલ્ય નહીં સમજે અને જો આપણે એવું વિચારીશું કે આપણી ગતિ કાયબાની છે તો આપણે સસલાની ગતિ નહીં કરી શકીએ. માટે પોતાનો પોતાના તરફનો દષ્ટિકોણ ખૂબ મહત્વનો છે.

આત્મવિશ્વાસ એ એક એવું ટોનિક છે જે આપણી કામ કરવાની ક્ષમતા વધારે છે. આવું જ કંઈક બાળકના પરિણામમાં જોવા મળે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આત્મવિશ્વાસ જ મદદરૂપ થાય છે. કોઈ વ્યક્તિ આપણને માર્ગદર્શન આપે રસ્તો દેખાડે પરંતુ એ માર્ગ પર ચાલવાનું તો આપણેજ હોય છે. બધા લોકો આપણને પ્રોત્સાહિત કરે પરંતુ મથવું તો આપણે જ પડે છે.

આપણી આગળ એક જ વ્યક્તિ હોય છે જે આપણને મંજિલ સુધી પહોંચાડે અને એ વ્યક્તિ અરીસામાં જોવાથી જ મળશે. બાકી બધા સાથે આપણે પરંતુ ધ્યેયને પહોંચવા જેટલો પ્રયત્ન અને ફાળો આપણો પોતાનો જ કામ લાગશે. માટે જ કહેવાય છે ને કે “હિંમતે મર્દા તો મદદે ખુદા”. કુછ કિયે બિના જયજયકાર નહીં હોતી કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી.

માટે સફળ જીવન જીવવાનો એક મંત્ર ખરેખર અપનાવવા જેવો છે અને તે છે **Love your self,  
Help your self.**



# દર્દ ઓઠ દવા ઓઠ



**બી.પી. દવે**  
માધ્યમિક શિક્ષક

- (૧) અછાહનું સર્વોત્તમ ઔષધ હરડે છે.
- (૨) અતિસાર (ઝાડા) નું સર્વોત્તમ ઔષધ સુંઠ છે.
- (૩) અર્નિદ્રાનું સર્વોત્તમ ઔષધ પીપરીમૂળ છે.
- (૪) અમ્લાષિતનું સર્વોત્તમ ઔષધ આમળા છે.
- (૫) અલસકનું સર્વોત્તમ ઔષધ લસણ છે.
- (૬) અરૂચિનું સર્વોત્તમ ઔષધ બીજોરૂં છે.
- (૭) અસ્થિભંગનું સર્વોત્તમ ઔષધ લાખ છે.
- (૮) આમવાતનું સર્વોત્તમ ઔષધ સુંઠ છે.
- (૯) આર્તવદોષનું સર્વોત્તમ ઔષધ કુંવાર છે.
- (૧૦) ઉધરસનું સર્વોત્તમ ઔષધ ભોરીંગણી છે.
- (૧૧) ઉનવાનું સર્વોત્તમ ઔષધ ગોખરૂં છે.
- (૧૨) ઉરઃશ્વતનું સર્વોત્તમ ઔષધ લાખ છે.
- (૧૩) ઉલટીનું સર્વોત્તમ ઔષધ કપૂર કાયલી છે.
- (૧૪) કબજિયાતનું સર્વોત્તમ ઔષધ હરડે છે.
- (૧૫) કમળાનું સર્વોત્તમ ઔષધ કુમળામૂળા છે.
- (૧૬) કાનના રોગનું સર્વોત્તમ ઔષધ સરસવ તેલ છે.
- (૧૭) કાકડાનું સર્વોત્તમ ઔષધ હળદર છે.
- (૧૮) કુમ્બિનું સર્વોત્તમ ઔષધ વાવડીંગ છે.
- (૧૯) કૃશતા (ખાતળાપણા) નું સર્વોત્તમ ઔષધ અશ્વગંધા છે.
- (૨૦) ગંડમાલાનું સર્વોત્તમ ઔષધ કાંચનાર છે.
- (૨૧) કોઠનું સર્વોત્તમ ઔષધ ખેરસાર છે.
- (૨૨) કોલેરાનું સર્વોત્તમ ઔષધ લીમડું છે.
- (૨૩) કાષનું સર્વોત્તમ ઔષધ અરડૂસી છે.
- (૨૪) ખુજલીનું સર્વોત્તમ ઔષધ લીમડું છે.
- (૨૫) ગ્રહણી (સંગ્રહણી) નું સર્વોત્તમ ઔષધ કોઠું છે.
- (૨૬) ગાંડપણનું સર્વોત્તમ ઔષધ ગ્રાહમી છે.
- (૨૭) ગૂમડાનું સર્વોત્તમ ઔષધ લીમડું છે.
- (૨૮) ગાળાનું સર્વોત્તમ ઔષધ લસણ છે.
- (૨૯) ચર્મરોગનું સર્વોત્તમ ઔષધ લીમડું છે.
- (૩૦) જવર (તાવ)નું સર્વોત્તમ ઔષધ ગળો છે.
- (૩૧) ઝેરનું સર્વોત્તમ ઔષધ સરસડું છે.
- (૩૨) ટાલનું સર્વોત્તમ ઔષધ કડવી પરવળ છે.
- (૩૩) તૃપાનું સર્વોત્તમ ઔષધ શેરડી છે.
- (૩૪) દાઝયાનું સર્વોત્તમ ઔષધ રાળ છે.
- (૩૫) ધાધરનું સર્વોત્તમ ઔષધ કુંવાડિયો છે.
- (૩૬) દંતરોગનું સર્વોત્તમ ઔષધ તલતેલ છે.
- (૩૭) નસકોરીનું સર્વોત્તમ ઔષધ દાડમના ફૂલ છે.
- (૩૮) નામદાઈનું સર્વોત્તમ ઔષધ કોચા છે.
- (૩૯) નેત્રરોગનું સર્વોત્તમ ઔષધ ત્રિકળા છે.
- (૪૦) પથરીનું સર્વોત્તમ ઔષધ પાષાણભેદ છે.
- (૪૧) પિત્તજવરનું સર્વોત્તમ ઔષધ ખડસલિયો છે.
- (૪૨) પ્રદરનું સર્વોત્તમ ઔષધ ભોયઆમલી છે.
- (૪૩) પ્રમેહનું સર્વોત્તમ ઔષધ આમળા છે.
- (૪૪) પાશ્વશુળનું સર્વોત્તમ ઔષધ પુષ્કરમૂળ છે.
- (૪૫) ક્લ્યુનું સર્વોત્તમ ઔષધ તુલસી છે.
- (૪૬) પાંડુનું સર્વોત્તમ ઔષધ સાટોડી છે.
- (૪૭) ખરોળનું સર્વોત્તમ ઔષધ પીપર છે.
- (૪૮) બહુમૂત્રનું સર્વોત્તમ ઔષધ ગળો છે.
- (૪૯) બાળરોગનું સર્વોત્તમ ઔષધ અતિવિષકળી છે.
- (૫૦) ભગંદરનું સર્વોત્તમ ઔષધ ગુગળ છે.
- (૫૧) ભ્રમનું સર્વોત્તમ ઔષધ ધમાસો છે.
- (૫૨) મરડાનું સર્વોત્તમ ઔષધ હરડે છે.
- (૫૩) મુખરોગનું સર્વોત્તમ ઔષધ ખેર છે.
- (૫૪) મૂંઢમારનું સર્વોત્તમ ઔષધ હળદર છે.
- (૫૫) મૂત્રાશયના રોગોનું સર્વોત્તમ ઔષધ સાટોડી છે.
- (૫૬) મંદાગ્નિનું સર્વોત્તમ ઔષધ આદુ છે.
- (૫૭) મંદવૃદ્ધિનું સર્વોત્તમ ઔષધ અસન છે.
- (૫૮) મેલેરિયાનું સર્વોત્તમ ઔષધ સપ્તપર્ણ છે.
- (૫૯) રક્તદોષનું સર્વોત્તમ ઔષધ સારિવા છે.
- (૬૦) રક્તપિત્તનું સર્વોત્તમ ઔષધ અરડૂસી છે.
- (૬૧) રક્તાર્શનું સર્વોત્તમ ઔષધ ઈંદ્રજલ છે.
- (૬૨) રક્તાતિસારનું સર્વોત્તમ ઔષધ કડાછાલ છે.
- (૬૩) લકવાનું સર્વોત્તમ ઔષધ ગુગળ છે.
- (૬૪) વધરાવળનું સર્વોત્તમ ઔષધ એરંડીયું છે.
- (૬૫) વ્રણનું સર્વોત્તમ ઔષધ લીમડું છે.
- (૬૬) વાઈનું સર્વોત્તમ ઔષધ બ્રાહમી છે.
- (૬૭) વાતજવરનું સર્વોત્તમ ઔષધ સુંઠ છે.
- (૬૮) વાળાનું સર્વોત્તમ ઔષધ હીંગ છે.
- (૬૯) વંધ્યત્વનું સર્વોત્તમ ઔષધ લક્ષમણા છે.
- (૭૦) વાયના રોગોનું સર્વોત્તમ ઔષધ રાસ્ના છે.
- (૭૧) શરદીનું સર્વોત્તમ ઔષધ આદુ છે.
- (૭૨) શૂળનું સર્વોત્તમ ઔષધ હીંગ છે.
- (૭૩) શ્વાસનું સર્વોત્તમ ઔષધ ભારંગમૂળ છે.
- (૭૪) સોજાનું સર્વોત્તમ ઔષધ પીલુડી છે.
- (૭૫) સ્વરભેદનું સર્વોત્તમ ઔષધ પુષ્કરમૂળ છે.
- (૭૬) હરસનું સર્વોત્તમ ઔષધ હરડે છે.
- (૭૭) હાથીપગાનું સર્વોત્તમ ઔષધ દેવદાર છે.
- (૭૮) હૃદયરોગનું સર્વોત્તમ ઔષધ અર્જુન છે.



# શાળા ની પ્રવૃત્તિઓ



ધ્યાન  
શિબિર



શનિવાર ની પ્રવૃત્તી





# વિશ્વ યોગ દિવસ



**YOGA  
FOR  
HEART CARE**





# એસ.કે.વી. વિધાલય -વર્માનગર

## શાળા નું ગૌરવ

(દોરણ-૧૦ ગુજરાતી માધ્યમ )

શાળાનું પરિણામ - ૫૫.૮૦ %

શાળામાં પ્રથમ સ્થાને



આચાર્ય માત્રા રાજેશભાઈ  
ગ્રેડ A2 - 518/600  
PR - 98.29

શાળામાં બીજા સ્થાને



કેસર જીગર પ્રવિણકુમાર  
ગ્રેડ A2 - 509/600  
PR - 97.75

શાળામાં ત્રીજા સ્થાને



ચૌહાણ અમી દિલીપભાઈ  
ગ્રેડ A2 - 508/600  
PR - 97.69

શાળામાં ત્રીજા સ્થાને



મકવાણા આશા કલેચાલાલ  
ગ્રેડ A2 - 508/600  
PR - 97.69

શાળામાં ચોથા સ્થાને



પટેલ મેશ્વા પ્રજ્ઞેશભાઈ  
ગ્રેડ A2 - 505/600  
PR - 97.48

શાળામાં ચોથા સ્થાને



જાડેજા આરતીબા ઘનશ્યામસિંહ  
ગ્રેડ A2 - 505/600  
PR - 97.48

શાળામાં પાંચમા સ્થાને



ઝડવી નીલેશદેવ રાસીબદાન  
ગ્રેડ B1 - 480/600  
PR - 95.29

(દોરણ-૧૦ અંગ્રેજી માધ્યમ )

શાળાનું પરિણામ - ૮૫.૪૫ %

શાળામાં પ્રથમ સ્થાને



SOPRATHIYA SWATI MAHENDRABHAI  
Grade A1 - 550/600  
PR - 99.62

શાળામાં બીજા સ્થાને



PATEL JAINISH HETALKUMAR  
Grade A1 - 545/600  
PR - 99.48

શાળામાં ત્રીજા સ્થાને



DESAI HETANGI PRABHATBHAI  
Grade A1 - 544/600  
PR - 99.45

શાળામાં ચોથા સ્થાને



RAJGOR KARAN SUNILKUMAR  
Grade A2 - 499/600  
PR - 97.03

શાળામાં પાંચમા સ્થાને



GOHIL CHITRANJIT UPASSTHIN  
Grade A2 - 497/600  
PR - 96.88

(દોરણ-૧૨ ગુજરાતી માધ્યમ )

શાળાનું પરિણામ - ૭૮.૬૨ %

શાળામાં પ્રથમ સ્થાને



સોઠા મહેન્દ્ર સિંહ ખેતાજી  
ગ્રેડ A2 - 581/700  
PR - 98.20

શાળામાં બીજા સ્થાને



સોઠા ધિશ્વરાજસિંહ ભાળવંતસિંહ  
ગ્રેડ A2 - 574/700  
PR - 97.78

શાળામાં ત્રીજા સ્થાને



જાડેજા વૃષાલીબા જયેશ્વરસિંહ  
ગ્રેડ A2 - 567/700  
PR - 97.32

શાળામાં ચોથા સ્થાને



ગાલા નંદનીબા મહિપાલસિંહ  
ગ્રેડ B1 - 555/700  
PR - 96.40

શાળામાં પાંચમા સ્થાને



નાગુ ભૂમિ નવિન  
ગ્રેડ B1 - 547/700  
PR - 95.65

